

Master of Yogic Science & A.T. Examination
History of Yoga and Philosophy - Paper-I

Time : 2-00 Hours]

May-2022

[Max. Marks : 50]

(A) નીચેનામાંથી ગમે તે ત્રણ પ્રશ્નોનાં જવાબ આપો :

- | | |
|--|----|
| ૧ યોગનો અર્થ સ્પષ્ટ કરી યોગની પરિભાષાઓ વર્ણવો. | ૧૪ |
| ૨ યોગના ઇતિહાસનું વર્ણન કરી સાંખ્યદર્શનમાં યોગનું સ્વરૂપ સ્પષ્ટ કરો. | ૧૪ |
| ૩ યોગના ઉદ્દ્દેશ અને વિકાસનું વર્ણન કરી શ્રીમદ્ ભગવદ્ગીતામાં યોગનું સ્વરૂપ સ્પષ્ટ કરો. | ૧૪ |
| ૪ ગુરુ ગોરખનાથ અને તેમનું યોગક્ષેત્રમાં યોગધાન વિસ્તારથી સમજાવો. | ૧૪ |
| ૫ મહર્ષિ પતંજલિ અને તેમનું યોગક્ષેત્રમાં યોગધાન વર્ણવો. | ૧૪ |
| ૬ મહર્ષિ પતંજલિ અનુસાર “ચિત્તવૃત્તિનિરોધ” સમજાવી તેને પ્રાપ્ત કરવાના ઉપાયો જણાવો. | ૧૪ |
| ૭ ચિત્ત પ્રસાદન એટલે શું? તેને પ્રાપ્ત કરવાના ઉપાયોનું સવિસ્તાર વર્ણન કરો. | ૧૪ |
| ૮ અષ્ટાંગયોગની માથભિક સમજ આપો ધમ-નિયમની તેના ફળ સહિત વિસ્તારથી ચર્ચા કરો. | ૧૪ |

(B) ટૂંકમાં જવાબો આપો (કોઈપણ ચાર) :

૦૮

- (૧) વેદોના ચાર ઉપભંડોના નામ ક્રમમાં લખો.
 - (૨) મુખ્ય છ આસ્તિક દર્શનના નામ તેના રૂચિપાત્ર સહિત જણાવો.
 - (૩) નવનાથના નામ જણાવો.
 - (૪) સાંખ્યદર્શન અનુસાર સૂચિરચનામાં અહંકારમાંથી ઉત્પત્ત થતા તત્ત્વોના નામ જણાવો.
 - (૫) યોગસૂત્ર મુજબ હેવ, હેવહેતુ, હાન, હાવોપાય જણાવો.
 - (૬) (અ) દુખદોર્મનસ્પાગમેજયત્વ શ્વાસપ્રશ્વાસા
 (બ) વિશેષાવિશેલિંગમાત્રાલિંગાનિ
 - (૭) યોગસૂત્ર અનુસાર આસન અને પ્રાણાયામના ફળ જણાવો.
 - (૮) (અ) કુવલ્યાનંદજીને બહાર પાઠેલ ત્રિમાસિકનું નામ
 (બ) દયાનંદ સરસ્વતી રચીત પુસ્તકનું નામ
-